

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનના પ્રાદેશિક કાઉન્સિલર પૉલ વિસેંટે (Paul Vicente) AMO નાં 2020-2022 બોર્ડ ઓફ ડાઈરેક્ટર્સમાં ચૂંટાયા

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓગસ્ટ 18, 2020) – આજે, બ્રેમ્પટનના પ્રાદેશિક કાઉન્સિલર પૉલ વિસેંટે (Paul Vicente) એસોસિએશન ઓફ મ્યુનિસિપાલિટીસ ઓફ ઓન્ટેરિયો (AMO) બોર્ડ ઓફ ડાઈરેક્ટર્સમાં બોર્ડના 2020-2022 સમયગાળા માટે પ્રાદેશિક અને સિંગલ ટિઅર કોંકસના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

AMO પ્રોવિન્સના અધિકાર ક્ષેત્રમાં આવતી નીતિ અને કાર્યક્રમ બાબતો પર ઓન્ટેરિયો મ્યુનિસિપાલિટીસના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. AMO નું બોર્ડ ઓફ ડાઈરેક્ટર્સ ઓન્ટેરિયો મ્યુનિસિપાલિટીસના વિવિધ સમૂહોનું પ્રતિનિધિત્વ કરતા 29 ચૂંટાયેલા મ્યુનિસિપલ અધિકારીઓ અને સંલગ્ન સભ્યોનું બનેલું છે.

AMO નાં 2020 વ્યૂહાત્મક હેતુઓ આ બાબતો પર આધારિત છે: ઓન્ટેરિયો સરકાર સાથે રચનાત્મક, પહેલેથી સક્રિય બનીને મ્યુનિસિપલ પ્રભાવ પાડવો; પ્રભાવ પાડવા ક્ષેત્રોમાં સહયોગ સાધવો; માહિતી, પૃથક્કરણ, હકીકતો અને મુખ્ય સંદેશાઓ વડે સભ્યની વકાલતને ટેકો આપવો; અને મ્યુનિસિપલ સરકારોને ટેકો આપતું શિક્ષણ અને કાર્યક્રમો પૂરા પાડવા.

સીટી ઓફ બ્રેમ્પટન ઓગસ્ટ 17 થી 19 સુધી AMO 2020 વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં સહભાગી થઈ રહ્યું છે. વધુ માહિતી [અહીં](#) મેળવો.

અવતરણો (ક્વૉટ્સ):

“કાઉન્સિલર વિસેંટે (Vicente) દ્વારા બ્રેમ્પટનનું AMO બોર્ડમાં સારી રીતે પ્રતિનિધિત્વ થશે. આપણે બ્રેમ્પટનને હરિયાળુ શહેર બનાવવા, આપણાં વિકાસનું અને COVID-19 નાં પ્રભાવોમાંથી આર્થિક રિકવરી માટેની માર્ગરેખાનું સંચાલન કરી રહ્યાં છીએ ત્યારે ઓન્ટેરિયોની મ્યુનિસિપાલિટીસ સાથે મળીને કામ કરવું રહ્યું અને વકીલાતનો ભાર વહેંચવો રહ્યો. કાઉન્સિલર વિસેંટેની બ્રેમ્પટન અને પીલ રીજીયનને વધારે સુદૃઢ બનાવવા માટેની કટિબદ્ધતા AMO સભ્યો માટે એક અસ્ક્યામત બની રહેશે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“હું AMO બોર્ડ ઓફ ડાઈરેક્ટર્સમાં ચૂંટાવવા બદલ સન્માન અનુભવું છું, અને સીટી ઓફ બ્રેમ્પટનની વિકાસ અને આર્થિક રિકવરી અગ્રતાઓને પ્રોવિન્સના સ્તરે લાવવા મેયર બ્રાઉન (Brown), મેયર ક્રોમ્બી (Crombie), મેયર થોમ્પસન (Thompson), પ્રમુખ ઇઆનિકા (Iannicca) અને આપણી કાઉન્સિલ સાથે કામ કરવા આશાવાદી છું.”

- પૉલ વિસેંટે (Paul Vicente), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी अंगेजमेन्ट

व्यूडाल्मिक संवाड

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca